

મહાપ્રબંધક

સરકારી એકાઉન્ટસ વિભાગ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એસોસિયેટ બેંકો

અલ્હાબાદ બેંક/બેંક ઓફ બરોડા / બેંક ઓફ ઇન્ડિયા/ બેંક ઓફ મહારાષ્ટ્ર / કેનેરા બેંક / સેન્ટ્રલ બેંક
ઓફ ઇન્ડિયા / કોર્પોરેશન બેંક / દેના બેંક / ઇન્ડિયન બેંક / ઇન્ડિયન ઓવર સીઝ બેંક / પંજાબ
નેશનલ બેંક / સિન્ડીકેટ બેંક / યુકો બેંક / યુનિયન બેંક ઓફ ઇન્ડિયા / યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા.

માનનીય સાહેબ

પબ્લીક પ્રો.ફંડ સ્કીમ, 1968-સ્પષ્ટતાઓ

કૃપા કરીને 14-મે-2005નો અમારો પરિપત્ર ક્રમાંક સી.ઓ.ડી.ટી. 15-02-2001 / એચ-9593-9615 / 2004-05 જુઓ જે 13 મે, 2005ના ભાવી સરકારના જાહેરનામા સાથે મોકલાવેલ છે. જે નાણા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરાયેલ છે અને તેનાથી મે, 13, 2005ની અસરથી પી.પી.એફ સ્કીમ 1968ની જોગવાઈઓમાં સુધારા કરવામાં આવ્યા છે.

2. આ અંગે ભાવી સરકારના નાણા મંત્રાલયે 20 મે, 2005ના પોતાના પત્રો એફ ક્રમાંક 2-8-2005 અને એસ-II થી નીચેની સ્પષ્ટતાઓ કરી છે.

- i) માત્ર વ્યક્તિગત ધોરણે જ રોકાણ થાય તેની શક્યતા નિયંત્રીત કરવામાંટે વિવિધ નાની બચત યોજનાઓમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં જ્યુરીસ્ટીક વ્યક્તિઓ (એચ.યુ.એફ ટ્રસ્ટ, પ્રો.ફંડસ વગેરે) જેમાં વ્યક્તિગત સિવાયના પર્સન હોય (સગીર અને અસ્થિર મગજની વ્યક્તિમાટે નિયમ પ્રમાણે બાલી દ્વારા સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટથી) જેમણે પબ્લીક પ્રો.ફંડ સ્કીમ, 1964 હેઠળ કોઈપણ નાની બચત યોજના હેઠળ 13 મે, 2005ના રોજ કે ત્યાર પછી રોકાણ કરેલ હોય તેને ગેર માન્ય ગણવામાં આવશે અને આવા એકાઉન્ટ તાત્કાલીક બંધ કરવામાં આવશે અને ડિપોઝીટરોને કોઈપણ વ્યાજ વગર ડિપોઝીટ પરત આપવામાં આવશે.
- ii) એ બાબતની જો કે નોંધ રાખવાની રહેશે કે ઉપરના સુધારા વર્તમાન એકાઉન્ટસને લાગુ નહિ પડે જે 13 માર્ચ, 2005ના સુધારાના નિયમો પહેલા મેળવવામાં આવ્યા હોય આવા એકાઉન્ટ પાકતી મુદત સુધી ચાલુ રહેશે અને આ એકાઉન્ટ માંથી ડિપોઝીટ ઉપાડ ઉપરના નિયમો મુજબ કરવા દેવામાં આવશે જે કે અત્યારના એકાઉન્ટમાં કોઈ પણ એક્સટેન્સન 13 મે, 2005ના સુધારાઓને આધિન રહેશે.

3. ઉપરની બાબતોને ધ્યાનમાં રાખતા તમે પી.પી.એફ. સ્કીમ, 1968 હેઠળ કામ કરતી ઉપરની તમામ શાખાઓ/ઓફિસોને તેનું ચુસ્તપણે પાલન કરવાં જણાવી શકશે.

4. કૃપા કરીને સ્વીકૃતી રસીદ આપો

આપનો વિશ્વાસુ

(ડિ.રાજગોપાલ રાવ)

ઉપ મહાપ્રબંધક